



॥ न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ॥

INDIAN INSTITUTE OF TEACHER EDUCATION

Near Mahatma Mandir, 'KH' Road, Sector 15,
Gandhinagar-382016 (Gujarat)
Ph.: 079-23243733/34, Website: www.iite.ac.in

આઇ.આઇ.ટી.ઇ.ખાતે કેન્ટીન સર્વિસ પૂરી પાડવા અંગે

આઇ.આઇ.ટી.ઇ.નાં મુખ્ય સંકુલ ખાતે કેન્ટીન સેવા પૂરી પાડવા માટેનું વાર્ષિક કામ માટે ઇજારદારોને આમંત્રિત કરવામા આવે છે. કામગીરીની વિગત અને આઇટમનુ વિગતવાર વિવરણ આ સાથે સામેલ છે.

કામનુ નામ	આઇ.આઇ.ટી.ઇ.નાં મુખ્ય સંકુલ ખાતે કેન્ટીન સેવા પૂરી પાડવાની કામગીરી
ડોક્યુમેન્ટ મેળવવાની તારીખ અને સમય	૦૨/૦૨/૨૦૨૨
દસ્તાવેજો સાથે પરત કરવાની તારીખ અને સમય	૧૪/૦૨/૨૦૨૨ ૧૮.૦૦ કલાક સુધી
સ્થળ મુલાકાત	આઇ.આઇ.ટી.ઇ. સેક્ટર-૧૫

આ અંગેના દસ્તાવેજ આઇ.આઇ.ટી.ઇ. ની વેબ સાઇટ www.iite.ac.in પરથી ડાઉનલોડ પણ કરી શકાશે, તૈયાર કરેલા આધાર પુરાવા સાથેના દસ્તાવેજો સીલબંધ કવરમા કુલસચિવશ્રી, આઇ.આઇ.ટી.ઇ. રામકૃષ્ણ પરમહંસ શિક્ષણ સંકુલ, ખ-રોડ, મહાત્મા મંદીરની બાજુમા.સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે અંતિમ તારીખ સુધીમાં મોકલવાના રહેશે. અંતિમ તારીખ બાદ મળેલા દસ્તાવેજો માન્ય રાખવામાં આવશે. નહિ.

કેન્ટીન સેવા પૂરી પાડવા અંગેની કામગીરીની વિગત અને શરતો.

1. આ કામગીરી અંગેના ભાવપત્રક તા. ૧૪/૦૨/૨૦૨૨ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં યુનિવર્સિટી ખાતે પહોંચતા કરવાના રહેશે. જેમાં દસ્તાવેજ ફી પેટેનો રૂ.૫૦૦/- નો ડી.ડી. “રજીસ્ટ્રાર આઈ.આઈ.ટી.ઈ.” નાં નામનો જોડવાનો રહેશે.
2. જ્યારે પસંગી પામેલ ઇજારદાર દ્વારા રૂ. ૨૫૦૦૦/- સિક્યુરિટી ડીપોઝીટ પેટે ભરવાના રહેશે.
3. દુકાન/ વ્યવસાય અંગેનો આધાર હોવો જોઈએ, જેમાં કોર્પોરેશન અથવા કંપની નોંધણી થયેલાનો આધાર જોડવાનો રહેશે.
4. ફૂડ & ડ્રગ્સનું માન્ય લાયસન્સ સાથે જોડવાનું રહેશે.
5. GST રજીસ્ટ્રેશનનો આધાર સાથે જોડવાનો રહેશે.
6. કેન્ટીનમાં ઉપયોગમાં લેવાતી દરેક સામગ્રી ISI & fssai દ્વારા માન્ય હોય તેવી જ સામગ્રી કે ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકશે.
7. કેન્ટીન સેવા પૂરી પાડનાર દ્વારા નશીલા પદાર્થો,તમાકુ,ગુટકા,સિગારેટ,બીડી, વગેરે જેવી સામગ્રી કે જે સ્વાસ્થ્ય માટે જોખમકારક અને શૈક્ષણિક સંકુલમાં પ્રતિબંધિત છે, તેનું વેચાણ કે સંગ્રહ કરી શકશ નહિ.
8. સંસ્થા દ્વારા વીજળી અને પાણીની સુવિધા આપવામાં આવશે. જેમાં લાઈટ,પંખો, અને પોઈન્ટ ફીઝ અને ઓવન માટેના આપવામાં આવશે. જેના સામે ઇજારદારે તેનો બિન જરૂરી ઉપયોગ કરવાનો રહેશે નહિ, જો આ પ્રકારનો ઉપયોગ ધ્યાનમાં આવશે તો તેનો દંડ ભરપાઈ કરવાનો રહેશે.
9. ઇજારદાર દ્વારા ચા-કોફી,દૂધ, છાશ અને ઠંડા પીણાનું વેચાણ કરી શકશ. જે અંગે સંસ્થાની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.
10. ઇજારદાર દ્વારા ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કરવાનો રહેશે નહિ, ગરમ કરવા અથવા બનવવા માટે ગેસનો ઉપયોગ કરવાનો રહેશે. જેની વ્યવસ્થા ઇજારદારે કરવાની રહેશે. જો સંસ્થાની ગેસ લાઈનનો ઉપયોગ કરશે તો જે-તે બિલ અને તેની મરામતનો ખર્ચ ઇજારદારે કરવાનો રહેશે.
11. નાસ્તામાં પેકિંગમાં આવતો નાસ્તો તેમજ ગરમ બનાવી તાજો નાસ્તો આપવાનો રહેશે.
12. કેન્ટીનમાં નાસ્તો કે ચા-કોફી વગેરે લીધા બાદ ફૂડ પોઈજનની સમસ્યા ઉભી થશે તો ઇજારદાર સંપૂર્ણ જવાબદાર રહેશે.
13. કેન્ટીનમાં તથા આજુબાજુની જગ્યાએ સાફ સફાઈ યોગ્ય રાખવી તેમજ કચરો કચરા પેટીમાં નાખી નિકાલ કરવાનો રહેશે. તેમજ ફૂડ વેસ્ટનો યોગ્ય નિકાલ સંસ્થા બહાર ઇજારદારે કરવાનો રહેશે.
14. ઓડેર મળ્યા બાદ આ કામગીરી દીવસ-૦૭ માં કાર્યરત કરવાની રહેશે.

15. કામગીરી દરમિયાન વોશ એરિયાથી લઇ અને પાણીના નિકાલ સુધીમા જો ગટરલાઇન બંધ થઇ જશે તો ઇજારદારે સ્વખર્ચે તેને યોગ્ય કરાવી આપવાની રહેશે.
16. સંસ્થામાં નુકશાન એજન્સી કે તેના માણસો દ્વારા નુકશાન થશે તો તેની ભરપાઈ એજન્સીએ કરવાની રહેશે.
17. મળેલા દસ્તાવેજોના આધારે કેન્ટીન ઇજારદારને કમિટી સમક્ષ પ્રેઝન્ટેશન માટે બોલાવવામાં આવશે, કમિટીની ભલામણ આધારિત ઇજારદારની પસંદગી થશે.
18. અન્ય વધુ માહિતી હેતુ તા:-૦૨/૦૨/૨૦૨૨ થી તા:-૧૪/૦૨/૨૦૨૨ સાંજના ૬:૦૦ વગ્યા સુધીમા કચેરી સમય દરમિયાન યુનિવર્સિટી ખાતે સંપર્ક સાધવો, આ અંગે એસ્ટેટ વિભાગમા માહિતી માટે સંપર્ક કરશો. ૦૭૯-૨૩૨૪૩૭૩૩/૩૪ EXT ૨૧૬
19. એજન્સીની કામગીરી/સેવા જો સંતોષકારક નહિ જણાય તો યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક અસરથી સેવાઓનો અંત લાવવામાં આવશે.
20. ઇજારદાર દ્વારા તેમના દ્વારા બંધ કરવાની હોઈ તેવા સંજોગોમાં દિવસ ૧૫ અગાઉ લેખિત જાણ કરવાની રહેશે.
21. એજન્સી/ઇજારદારનો ઓછામાં ઓછો કેન્ટીન/મેસ/અથવા ભોજન અંગેનો ૩ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
22. એજન્સી દ્વારા કામ પર રાખેલા કે કેન્ટીનમાં કામ કરતા તમામ લોકો નિર્વ્યસની હોવા જોઈએ.
23. કેન્ટીનમાં કામ કરતા દરેક માણસનું આરોગ્ય સ્વસ્થ હોવું જોઈએ.
24. પ્રવર્તમાન સમય અન્વયે કોરોના અંગેની સરકારશ્રીની ગાઈડલાઈન્સનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.
25. કેન્ટીનનો સમય સવારે ૭.૦૦ થી સાંજના ૮.૦૦ સુધી રહેશે. રજાના દિવસોમાં કેન્ટીન બંધ રાખવાની રહેશે. કાર્યક્રમો દરમિયાન તેમજ અન્ય હેતુ વધુ સમય માટે કેન્ટીન ખુલ્લી રાખવાની થાય તેવા સંજોગોમાં સંસ્થાની મંજૂરી લેવાની રહેશે.
26. સંસ્થાના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને મુલાકાતીઓને જ આ સેવા આપવાની રહેશે, બહારથી કોઈપણને પ્રવેશ આપી શકાશે નહિ.
27. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ચા-કોફી-નાસ્તો કે ભોજનમાં કરવાનો રહેશે નહીં.
28. કામ પર રાખેલા કામદારો સંસ્થાના કર્મચારી ગણાશે નહિ. કામ પર રાખેલા કામદારો અથવા તો કેન્ટીન ચલાવનારનાં આધાર પુરાવા આપવાના રહેશે.
29. કોઈપણ પ્રશ્ન ઉદ્ભવે તો પ્રથમ કુલસચિવશ્રી અને ત્યારબાદ માન.કુલપતિશ્રીનો નિર્ણય આખરી રહેશે.
30. ઇજારદારની પસંદગી કમિટી દ્વારા તેના દસ્તાવેજો અને કામગીરીના અનુભવના આધારે કરવામાં આવશે.

31. પસંદગી પામેલા ઇજારદારે ભોજન, નાસ્તો તેમજ અન્ય વસ્તુઓ માટે આઈ.આઈ.ટી.ઈ.ની કમિટી સાથે બેસી નક્કી કરેલ ભાવ મુજબ જ રકમ લેવાની રહેશે.
32. ઇજારદારે સેવાના બદલામાં લેવાના થતા નાણા જે-તે વિદ્યાર્થી, કર્મચારી, મહેમાન પાસેથી લેવાના રહેશે, સંસ્થા દ્વારા કોઈપણ રકમ આપવામાં આવશે નહિ,
33. સંસ્થા ખાતે ઉપયોગમાં લેવાતા ભોજનાલય, લાઈટ,પાણી વગેરે સેવાઓ પેટે દર મહીને રૂ. જમા કરવવાના રહેશે.
34. જ્યારે પણ ઇજારદારને ભોજનાલય,રસોડું,સ્ટોર, ભોજનાલય, લાઈટ,પંખા વગેરે વસ્તુઓ સોંપવામાં આવે ત્યારે જે પરિસ્થિતિમાં પરત કરતી વખતે આપવાના રહેશે.
35. ભોજનાલય ,રસોડું,સ્ટોર રૂમ વગેરેની સાફ-સફાઈ અને યોગ્ય સ્વચ્છતા જાળવાઈ રહે તેની સંપૂર્ણ જવાબદારી ઇજારદારની રહેશે.
36. ઇજારદારની પસંદગી તેના કરેલા કામો, આર્થિક સક્ષમતા, તેમજ કમિટીના અહેવાલના આધારે નક્કી કરવામાં આવશે, જરૂર જણાયે ઇજારદારોને તેમના કામ અંગેનું પ્રેઝન્ટેશન કરવાનું રહેશે.
37. ઇજારદાર દ્વારા કરાર કર્યાબાદ કામગીરી હાથ ધરવાની રહેશે.

પાર્ટી/એજંસી/કોંટ્રાક્ટરની વિગત:

1. નામ અને સરનામુ :
2. પાર્ટી/એજંસી/કોંટ્રાક્ટરની માહિતિ :
3. સંપર્ક નંબર :
4. ઇ-મઈલ :
5. રજીસ્ટ્રેશન/નોંધણીની વિગત :
6. પાન કાર્ડ નંબર
7. કરેલા કામના અનુભવની માહિતિ :
8. GST નંબર :-

પાર્ટી/એજંસી/કોંટ્રાક્ટરની સહી